



SAMPANN UTPADAN INDIA LIMITED

(FORMELY KNOWN AS S E POWER LTD)

CIN NO. L40106GJ2010PLC091880

Date:18.10.2025

The Manager
Department of Corporate Relationship
BSE Limited
25th Floor P. J. Towers, Dalal Street
Mumbai -400 001
Scrip Code: 534598

The Listing Department
National Stock Exchange of India Limited
Exchange Plaza, Bandra Kurla Complex
Bandra (East)
Mumbai -400 051
SCRIP SYMBOL: SAMPANN

Sub.: Intimation regarding Publication of Financial Results in Newspapers

Dear Sir/Madam

Please find attached herewith the copy of Newspapers in which the financial results of the Company for the quarter ended September 30, 2025, as approved by the Board of Directors of the company in their meeting held on October 17, 2025, were published on October 18 2025, pursuant to applicable regulations of SEBI(LODR) Regulations, 2015.

Kindly keep the same in your record.

Thanking You,

Yours Faithfully,

For Sampann Utpadan India Limited
(Formerly Known as S. E. Power Limited)

(Saurabh Agrawal)
Company Secretary

Encl.: As above

Aadhar Housing Finance Ltd.

Corporate Office: Unit No. 802, Natraj Rustomjee, Western Express Highway and M.V. Road, Andheri (East), Mumbai - 400069.

Mulendranagar Branch : Shop No.327, 328 & 329, 3rd Floor, Mega Mall, Near Milan Cinema, S.T. Road, Surendranagar - 363001 (Gujarat)

Botad Branch: Office No. 302, Royal Plaza, C.S.No. 5561, Sheet No.76, District Botad - 364710 (Gujarat)



APPENDIX IV POSSESSION NOTICE (for immovable property)

Whereas, the undersigned being the Authorized Officer of **Aadhar Housing Finance Limited (AHFL)** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, Demand Notice(s) issued by the Authorised Officer of the company to the Borrower(s) / Guarantor(s) mentioned herein below to repay the amount mentioned in the notice within **60 days** from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower(s) / Guarantor(s) and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of the Section 13 of the said Act read with Rule 8 of the Security Interest Enforcement rules, 2002. The borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of AHFL for an amount as mentioned herein under with interest thereon.

Sr. No.	Name of the Borrower(s)/ Co-Borrower(s) (Name of the Branch)	Description of Secured Asset (Immovable Property)	Demand Notice Date & Amount	Date of Possession
1	(Loan Code No. 03700000449, 03700000450 & 03710000720/ Surendranagar Branch & Loan Code No. 32510000286/ Botad Branch) Mukeshbhai Bhudarbhai Dharajiya (Borrower) Marabhai Bhudarbhai Dharajiya & Rajjithbhai Bhudarbhai Dharajiya (Co-Borrowers) Vipulbhai Savjibhai Dhola (Guarantor)	All that part & parcel of property bearing, 417 Paikee Plot No 20 Paikae East Side Paikae North Side Makan No. 6 Gopinath Gadhada Road, Botad, Gujarat, 364710. Boundaries : East - Mt 5.94, This Side Lagu Road, West-Mt.5.94, This Side Remaining Land Of This Plot, North - Mt.11.13, This Side Lagu Other Survey No., South - Mt.11.13, This Side Road	10-07-2025 & ₹ 30,15,082/-	14-10-2025
Place : Gujarat Date : 18-10-2025		Authorised Officer Aadhar Housing Finance Limited		

CIN - U65922KL2011PLC029231
Corporate Office: Muthoot Homefin (India) Ltd, 19/E, The Ruby, Senapati Bapat Marg, Tulsi Pipe Road, Near Ruparel College, Dadar West, Mumbai - 400028.
Branch Office: Muthoot Homefin (India) Ltd, 503, Sapphire House,LP Savani Road, Nr.,Madhvan Circle Adajan, Surat Gujarat- 395009

APPENDIX-IV-A (See proviso to Rule 8(6))

PUBLIC NOTICE FOR PRIVATE TREATY CUM SALE

Pursuant to taking possession of the secured asset mentioned hereunder by the Authorized Officer of Muthoot Homefin (India) Ltd. under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 for the recovery of amount due from borrower/s, offers are invited by the undersigned in sealed covers for purchase of immovable property, as described hereunder, which is in the possession, on 'As Is Where Is Basis', 'As Is What Is Basis' and 'Whatever Is There Is Basis', Particulars of which are given below:-

Sr. No.	Borrower(s)/ Co-Borrower(s)/ Guarantor(s) / Loan Account No. / Branch	Demand Notice Date and Amount	Description of the Immovable property	Reserve Price	Earnest Money Deposit (EMD) (10% of RP)
1.	Vinod Sevalal Vishvakarma/ Ushadevi Vinod Vishvakarma/ 004-00401564/ Surat	26-Dec-2020/ Rs. 5,05,068/- Rupees Five Thousand Sixty Eight Only.	C 203 2Nd Radha Raman Residency Shree Lakshminarayana Society Surat Bardoli Road Surat Gujarat 394327. More Particularly Mentioned In The Sale Deed Registered No. 12784, Dated- 06/09/2017. In The Office Of Sub Registrar Palsana Having Boundaries- North- Society Road, South- Adj Building , East- B Wing, West- Adj Building	Rs. 2,00,000/- Rupees Twenty Thousand Only.	Rs. 20,000/- Rupees Twenty Thousand Only.

- The Auction is being held on "AS IS WHERE IS" AND "AS IS WHAT IS" basis
- The detailed terms and conditions of the auction sale are incorporated in the prescribed tender form, available at the above mentioned regional office.
- Last Date of Submission of Sealed Bid/Offer in the prescribed tender forms along with EMD payable by way of Demand Draft in Favor of 'Muthoot Homefin (India) Ltd.' along with KYC is on **07-Nov-2025 till 04:00 PM** at Regional Office the address mentioned herein above. Tenders that are not filled up completely or tenders received beyond last date will be considered as invalid tender and shall accordingly be rejected. No interest shall be paid on the EMD.
- Date of Inspection of the Immovable Property is on **06-Nov-2025 between 01:00 P.M. to 03:00 P.M.**
- Date of Opening of the Bid/Offer Auction Date for Property is **08-Nov-2025** at the above mentioned Branch Office address at **01:00 PM**, by the Authorised Officer.
- The MHFL shall not be responsible for payment of any outstanding statutory notice & Encumbrances / taxes arrears etc. if any & their Responsible to pay the sum would be that of the successful auction purchase. The Intending bidder should make their own independent inquiries regarding the Encumbrances Title of property & also inspect & satisfy themselves.
- The Highest bidder shall be subject to approval of MHFL Ltd. Authorised Officer shall Reserve the right to accept all any of the offer / Bid so received without assign any reason whatsoever. His decision shall be final and binding.
- The Borrower(s)/Guarantor(s) are hereby given 15 DAYS SALE NOTICE UNDER THE SARFAESI Act, 2002 to pay the sum mentioned as above before the date of Auction failing which the immovable property will be auctioned and balance, if any, will be recovered with interest and costs. If the Borrower pays the amount due to Muthoot Homefin (India) Ltd, in full, before the date of sale, auction is liable to be set aside.
- For further details, contact the Authorised Officer, at the above mentioned Office address Contact Person- **Amar Patil- 9737057744**
Date : October 18, 2025
Place: Surat

Sd/- Authorized Officer,
Muthoot Homefin (India) Limited

SBI STATE BANK OF INDIA

Stressed Assets Recovery Branch (10059) : 2nd Floor, Samyak Status, Opp. D R Amin School, Divivalpura Main Road, Vadodara - 390007.

Notice is hereby given under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13 (12) read with rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002, a demand notice was issued on the dates mentioned against each account and stated hereinafter calling upon them to repay the amount within 60 days from the date of receipt of said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property described herein below in exercise of power conferred on him/her under section 13(4) of the said Act read with Rule 9 of the said Act on the dates mentioned against each account. The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **State Bank of India** for an amount and interest thereon.

The Borrowers attention is invited to provisions of Sub-section(8) of Section 13 of the Act, in respect of time available to redeem the secured assets.

Name of Account/ Borrower & Address	Name of Proprietor/ Partners/Guarantors/ Owner of property etc.	Description of the Properties Mortgaged / Charged	Date of Demand Notice Type of Possession	Amount Outstanding as per Demand Notice
Shri Ashishkumar Simalbhai Baria (Borrower)	Owner of Property : Shri Ashishkumar Simalbhai Baria	All that piece of parcel of Immovable property at Paiki Plot No. 08 as per record admeasuring 703.26 sq mtrs Paiki North Side admeasuring 6780.00 sq feet, newly Map admeasuring 629.87 Sq mtrs land in "Jaimini Welly", Khata No. 456, R.S. No. 116A/Paiki 1, admeasuring 18374 sq mtrs at Jhalod Road, Village - Usarwan, Tal: Dahod, Registration District & Sub District - Dahod, (owned by Shri Ashishkumar Simalbhai Baria). Bounded by :- East : Lagu R.S. No. 115 Paiki, West : Road, North : Plot No. 7, South : As per Plot No. 8 security cabin	Date of Demand Notice : 04.07.2025 Date of Possession: 15.10.2025 Symbolic Possession	Rs. 2,14,74,919.37 (Rupees Two Crore Fourteen Lakh Seventy Four Thousand Nine Hundred Nineteen and Paise Thirty Seven only) as on 04.07.2025 less recovery thereafter together with further interest at the contractual rate on aforesaid amount together with incidental expenses, costs and charges thereon.
Date : 15.10.2025 Place : Dahod		Authorised Officer, State Bank of India		

SBI STATE BANK OF INDIA

RETAIL ASSETS CENTRAL PROCESSING CENTRE, 2nd/3rd Floor, Kalpataru Building, Opp. Narmada Guest House, Opp. GERI, Compound, Subhanpura Cross Road, Ellora Park, Vadodara-390023. Ph : 0265-2397046, 2397047 & 2397048

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES Appendix - IV-A [See Proviso to rule 8 (6)]

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the **Physical Possession** of which has been taken by the Authorised Officer of **State Bank of India**, the Secured Creditor, will be sold on "As Is Where Is", "As Is What Is" and "Whatever there is" basis for recovery of their dues to the secured creditor from under mentioned borrower(s)/ guarantor(s). The Bidders should get themselves registered on **BAANKNET.com** by providing requisite KYC documents and registration fee as per the practice followed by **PSB Alliance Pvt. Ltd.** well before the auction date.

Date & Time of E-Auction 04.11.2025 from 11:00 AM to 4:00 PM (with unlimited extensions clause of 10 minutes)				
Sr. No.	Borrower(s) & Guarantor(s) Details of Demand Notice With further interest / expenses	Details of Property	Reserve Price EMD Bid Increase Amount	Date & Time of inspection/ Contact Person
1	Shri. Akash Soni Rs.56,66,450.00 ----- 18.03.2025	Property ID: SBIN200082433743 4 BHK Residential Flat: All that piece and parcel of land and ground together with the building(s) hereinafter and premises standing thereon in the property situated at Flat No.A-1/101, 1st Floor, Tower-A1, Ratnam Luxuria, Hami, Vadodara. Registration Dist. Vadodara Sub Dist. Vadodara, Mouje Hami RS No.175 Paiki 1, TP No.2 (Hami), FP No.24, Built Up Area 139.95 Sq.Mtr., Carpet Area 129.82 Sq.Mtr., Undivided Common Plot & Land Area 53.90 Sq.Mtr. owned by Mr. Akash Soni.	69,00,000.00 6,90,000.00 10,000.00	28/10/2025 11:00 AM to 01:00 PM Rajendrakumar Baheshwar 9714457559
Encumbrances: To the best of knowledge and information of the Authorised Officer, there are no other encumbrances advised to the Bank. The intending bidders should make their own independent inquiries regarding the encumbrances, title of properties/put on auction and claims/ rights/ dues affecting the property, prior to submitting their bid. The e-Auction advertisement does not constitute and will not be deemed to constitute any commitment or any representation of the bank. The properties are being sold with all the existing and future encumbrances whether known or unknown to the bank. The Authorised Officer/ Secured Creditor shall not be responsible in any way for any third party claims/ rights/ dues. TDS/ GST, wherever applicable, will have to be borne by the successful bidder / buyer, over and above the bid amount. Sale Confirmation will be subject to consent of mortgagor/borrower if auction does not fetch more than the reserve price as per provision of SARFAESI rule 9 (2). THIS NOTICE SHOULD ALSO BE CONSIDERED AS 15 DAYS NOTICE TO THE BORROWER/ GUARANTORS / MORTGAGORS UNDER RULE 8 (6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULE 2002. For detailed terms and conditions of the sale, please refer to the link provided in State Bank of India, the Secured Creditor's Website https://sbi.co.in/web/sbi-in-the-news/auction-notices/sarfaesi-and-others & BAANKNET.com Date: 18.10.2025 - Place: Vadodara Authorised Officer, State Bank of India				

<div> <p>पंजाब नैशनल बैंक punjab national bank ...भरने का प्रतीक ! ...the name you can BANK upon !</p> </div>					
B.O.:Trade House, Surat – 395002. Tele: 0836-2447800/7259009375. Email:bo052120@pnb.co.in.					
A notice is hereby given that the following Borrowers - BHUPATBHAI D LADUMOR (BORROWER) and RAMBHABEN BHUPATBHAI AHIR (Co-BORROWER) have defaulted in the repayment of principal and interest of the loan facility obtained by them from the Bank, and the loan account have been classified as Non-Performing Assets (NPA). The repayment of said loan facilities is guaranteed by Mr. Dhirubhai P Baldaniya.(Guarantor) . The notices were issued to them under Section 13(2) of Securitization and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 on their last known addresses, but they have been returned unserved and as such they are hereby informed by way of this public notice.					
S. No.	Name of the Borrower(s)/ Guarantors	Details of Properties/ Address of Secured Assets to be Enforced	Date of Notice	Date of NPA	Amount outstanding (Principal + Interest + Charges)
1	Bhupatbhai D Ladumor (Borrower)	All that piece and parcel of the property bearing Plot No.35 admeasuring 47.40 sq.mtrs. (after revision Survey New Block No.2378 adm.47.00 Sq.mtrs.) with proportionate undivided inchoate share of land of Road and C.O.P. admeasuring 24.76 Sq. mtrs. of Radhakrishna Residency situated at Revenue Survey No.184/1, Block No.192 admeasuring Hector 0-80-86 Aare at moje Mankna, Sub District Kamrej, District Surat.	10/09/2025	29/08/2025	8,31,023.52/-
2	Rambhaben Bhupatbhai Ahir (Co Borrower)				
3	Mr. Dhirubhai P Baldaniya. (Guarantor)				

The above Borrowers and their Guarantor are hereby called upon to make payment of outstanding amount within 60 days from the date of publication of this notice, failing which further steps will be taken after expiry of 60 days from the date of this notice under sub-section (4) of Section 13 of Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002.

As per Sub-Section 13 of Section 13 the borrower shall not transfer by sale, lease or otherwise the said secured assets stated above without obtaining written consent of the Bank.

The borrower's attention is invited to provisions of Sub-section (8) of Section 13 of the Act, in respect of time available to redeem the secured assets.

Date : 10/09/2025 | Place : Surat
Authorised Officer, Punjab National Bank

HDFC Bank Limited

Branch : **HDFC House, Near Mithakali Six Lane Road, Navrangpura Ahmedabad-380009. Tel: 079-26563379**

Whereas the Authorised Officer of HDFC Bank Limited (erstwhile HDFC Limited having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023) (HDFC), under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 ("said Act") and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices under Section 13 (2) of the said Act, calling upon the following borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) to pay the amounts mentioned against their respective names together with interest thereon at the applicable rates as mentioned in the said notices, within 60 days from the date of the said Notice(s), incidental expenses, costs, charges etc till the date of payment and / or realisation.

Sr. No.	Name of Borrower (s) / Legal Heir(s) and Legal Representative(s)	Outstanding Dues	Date of Demand Notice	Date of Possession	Description of Immovable Property (ies) / Secured Asset (s)
A	B	C	D	E	F
1	MR. PRAJAPATI VIRAMABHAI KARSHANBHAI (Borrower) MRS PRAJAPATI CHEHARIBAI (POA HOLDER)	Rs. 18,85,266/- and Rs. 12,36,985/- dues respectively as on 31-May-2025*	02-JUL-2025	15-OCT-25 (Symbolic Possession)	UNIT-C-23 AKASH VILLA 1 & 2 S NO 210/1 P1, NR. RAMESHWAR MAHADEV TEMPLE, OPP DECENT HOTEL, DEESA-PALANPUR HIGHWAY, BHOYAN, DEESA: 385535

*With further interest as applicable, incidental expenses, costs, charges etc incurred till the date of payment and / or realisation.

However, since the borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove have failed to repay the amounts due, notice is hereby given to the borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and to the public in general that the Authorised Officer/s of HDFC have taken physical possession of the immovable property (ies) / secured asset(s) described herein above in exercise of powers conferred on him/ them under Section 13 (4) of the said Act read with Rule 8 of the said Rules on the dates mentioned above.

The borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and the public in general are hereby cautioned not to deal with the aforesaid Immovable Property(ies) / Secured Asset(s) and any dealings with the said Immovable Property (ies) / Secured Asset(s) will be subject to the mortgage of HDFC.

Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) attention is/are invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secured assets.

Copies of the Pnchamna drawn and Inventory made are available with the undersigned, and the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) is / are requested to collect the respective copy from the undersigned on any working day during normal office hours.

Date : 17.10.2025
Place : Deesa
Authorised Officer,

Regd Office: HDFC Bank Ltd. HDF Bank House, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai-400013. CIN: L65920MH1994PLC080618 Website: www.hdfcbank.com

ADITYA BIRLA HOUSING FINANCE LIMITED

Registered Office- Indian Rayon Compound, Veraval, Gujarat – 362266
Branch Office- G-Corp Tech Park, 8th floor, Kasar Wadavali, Ghodunder Road, Thane, MH-400001

DEMAND NOTICE (under Rule 3 (1) of Security Interest (Enforcement) Rules, 2002)

Substituted Service Of Notice U/S 13 (2) Of Securitisation And Reconstruction Of Financial Assets And Enforcement Of Security Interest Act, 2002.

Notices is hereby given to the borrowers as mentioned below that since they have defaulted in repayment of the Credit facility availed by them from **Aditya Birla Housing Finance Limited (ABHFL)**, their loan accounts have been classified as **Non-Performing Assets** in the books of the Company as per RBI guidelines thereto. Thereafter, ABHFL has issued demand notices under section 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (SARFAESI Act) on the last known addresses of the said borrowers thereby calling upon and demanding from them to repay the entire **outstanding amount** together with further interest at the contractual rate on the aforesaid amount and incidental expenses, cost, charges etc. as stated in the said demand notices. However, the demand notice is also being served by way of publication, as per Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 (SARFAESI Rules):

Sl. No.	Name and Address Borrower/ Co-Borrower and Guarantor / Co-Guarantor & Loan A/C No.	NPA Date	Date of Demand Notice	Amount due as per Demand Notice /as on Date
1	1. SAGATHIYA AMIT House No.673, Mota Gundala Jetpur Rajkot, Gujarat, 360370. 2. PARMAR PRIYANKA RAMESHBHAI House No.673, Mota Gundala Jetpur Rajkot, Gujarat, 360370. 3. SAGATHIYA AMIT Mota Gundala, Jetpur, Shree Park B/H Gujarati Vadi Nr Gardan Mota Gundala, Mota Gundala, Jetpur, Rajkot, Gujarat, 360370. 4. PARMAR PRIYANKA RAMESHBHAI Mota Gundala, Jetpur, Shree Park B/H Gujarati Vadi Nr Gardan Mota Gundala, Mota Gundala, Jetpur, Rajkot, Gujarat, 360370. 5. SAGATHIYA AMIT C/O Yogi Automation Near Raviraj Plastic Survey No 214, Plot No 5 Yogi Automation Veraval (Shapur), Rajkot, Gujarat, 360024. Loan Account No. LNRKTLAP-07240219836 & LNRKTLAP-07240219839	01.10.2025	13-10-2025	Rs. 7,12,365.8/- (Rupees Seven Lac Twelve Thousand Three Hundred Sixty Five and Eight Paise) by way of outstanding principal, arrears (including accrued late charges) and interest till 07.10.2025

DESCRIPTION OF IMMOVABLE PROPERTY/PROPERTIES MORTGAGED: All That Piece And Parcel Of Immovable Property Being A Residential House Land Area 77-50 Sq. Mt. O Milikat No. 673 Construction Thereon Situated On Gamtil Land Of Majje Village Motagundala Sub District Jetpur, District Rajkot Gujarat 360370 And **Bounded As: East: Road West: House Of Sombhai Sidibhai Sagathiya North: House Of Natubhai Patel South: Others Property**

We hereby call upon the borrower stated herein to pay us within 60 days from the date of this notice, the outstanding amount (s)together with further interest thereon plus cost, charges, expenses, etc. thereto failing which we shall be at liberty to enforce the security interest including but not limited to taking possession of and selling the secured asset entirely at your risk as to the cost and consequences.

Please note that as per section 13(13) of the SARFAESI Act, all of your are prohibited from transferring by way of sale, lease or otherwise, the aforesaid secured assets without prior written consent of the Company. Any contravention of the said section by you shall invoke the penal provisions as laid down under section 29 of the SARFAESI Act and / or any other legal provision in this regard.

Please note that as per sub-section (8) of section 13 of the Act, if the dues of ABHFL together with all costs, charges and expenses incurred by ABHFL are tendered to ABHFL at any time before the date fixed for sale or transfer, the secured asset shall not be sold or transferred by ABHFL, and no further step shall be taken by ABHFL or transfer or sale of that secured asset.

Date: 18.10.2025
Place: RAJKOT
Sd/- Authorised Officer
(Aditya Birla Housing Finance Limited)

SAMPANN UTPADAN INDIA LIMITED

(Formerly Known as S. E. Power Limited)
CIN : L40106GJ2010PLC091880

Regd. Off: Survey No. 54/B, Pratapnagar, Jarod-Savli Road, Samlaya, Vadodara-391520 (Guj.)

Tel.: +91 2667 251566, E-mail: cs@sepower.in, Website: www.sepower.in

EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER/HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2025

(₹ in Lacs except EPS)					
Particulars	Quarter Ended		Half Year Ended		Year Ended
	30.09.2025	30.09.2024	30.09.2025	30.09.2024	31.03.2025
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
Revenue from operations	3484.36	2109.73	6752.32	4129.07	9750.88
Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	247.87	(150.58)	492.36	(356.14)	(273.49)
Net Profit for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	247.87	(150.58)	492.36	(356.14)	537.74
Net Profit for the period after tax	185.44	(112.70)	368.44	(266.70)	397.59
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	185.44	(112.70)	238.44	(266.70)	397.59
Paid up Equity Share Capital (Face value of Rs. 10/- per share)	4881.00	4061.00	4881.00	4061.00	4061.00
Reserves excluding Revaluation Reserves (as per balance sheet of previous accounting Year)	—	—	—	—	(3147.56)
Earnings per Share (of Rs. 10 each) (not annualised)	0.38	(0.28)	0.75	(0.66)	0.98
Basic & Diluted:					

Notes:
1) The key standalone financial information of the Company is as under:

Particulars	Quarter Ended		Half Year Ended		Year Ended
	30.09.2025	30.09.2024	30.09.2025	30.09.2024	31.03.2025
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
Revenue from operations	3484.37	2109.72	6752.32	4129.07	9750.88
Profit before tax	248.21	(150.25)	493.04	(355.55)	(272.21)
Profit after tax	185.74	(112.43)	368.95	(266.22)	398.55

2) The above is an extract of the detailed Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results (Consolidated/Standalone) are available on the website i.e. www.sepower.in and on the Stock Exchanges' websites i.e. www.bseindia.com and www.nseindia.com.

3) The same can be accessed by scanning the QR code provided below:

Place : Vadodara
Date : 17.10.2025
For and on behalf of Board of Directors
Sd/-
(SACHIN AGARWAL)
Managing Director

PUBLIC NOTICE

The public at large take notice that Nirav Resins Private Limited has acquired All that undivided share and Common Road in the Non-Agricultural land located in the

કરજણ-વાડી પાઈપલાઈન યોજનાની કામગીરી અધુરી છતાં ઉદ્ઘાટન

ભરૂચ, તા.૧૭

ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ જીલ્લાના વાલીયા-ઝઘડીયા અને સુરત જીલ્લાના માંગરોલ તાલુકાની કુલ-૭,૫૦૦ હેક્ટર જમીનને સિંચાઈ માટેનું પાણી મળી શકે તે માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરીને રૂ.૩૦૦ કરોડના ખર્ચે કરજણ-વાડી પાઈપલાઈન યોજના મંજૂર કરાવી હતી. આ સિંચાઈ યોજના મંજૂર થઈ ત્યારે તેના વડંતોરમાં જણાવ્યું હતું કે, મોટીભમરી પાસે કરજણ જળાશયમાંથી કિલકીંગ કરીને પાઈપલાઈન મારફતે કામગીરી કરવામાં નહીં આવતાં બેઝુતોના બેતરમાં જ સીધું ભરૂચ લોકસભા સાંસદ મનસુખ કેબીનેટ મંત્રી કુંવરજી ભાવળીયાને જવાબદાર કોન્ક્રીટકર-ભાજપની નેતાગીરીએ રાતોરાત બોલાવીને તેનું ઉદ્ઘાટન કરી નાખ્યું હતું. પરંતુ ભાજપના પ્રમુખ મનસુખ વસાવા, રાયસેન્ટ્રલ વસાવા અને સ્થાનિક રાયસેરો-ખેડુતોને જાણ શુદ્ધ કરવામાં આવી ન હતી. જવાબદાર કોન્ક્રીટકરે નદી-નાળા અને કોતરોમાં કરજણ જળાશયનું પાણી છોડીને કામગીરી પુરી કરીને લાખો-કરોડો રૂપિયા રાજ્ય સરકાર પાસે લઈ લીધા છે. પરંતુ ખેડુતોના બેતરમાં જ સીધું સિંચાઈ

કરજણ-વાડી સિંચાઈ યોજનામાં વધારાની ગ્રાન્ટની ફાળવણી કરો :- સાંસદ મનસુખ વસાવા

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં કરજણ જળાશય યોજનામાં વિશ્વભાખડી સિંચાઈ પ્રોજેક્ટ પુર્ણ થયો છે. જેનું લોઅર્થ થયું છે. પરંતુ આ પ્રોજેક્ટનું પાણી કોતરોમાં છોડવામાં આવે છે. જેને સમયે ખેડુતોને સમજાવ્યું હતું કે, તમારા ખેતરો સુધી આ સિંચાઈનું પાણી મળવાનું છે, અને અમારી વાતને ધ્યાનમાં લઈને ખેડુતોએ સહકાર આપ્યો હતો. પરંતુ ખેડુતોને પાણી નહીં મળતા આ પ્રોજેક્ટમાં વધારાની ગ્રાન્ટ આપી ખેડુતોને સિંચાઈનું પાણી આપવું જોઈએ.

માટેનું પાણી આપવાનું હતું તે પ્રકારની કામગીરી નહીં કરતાં આદિવાસી વિસ્તારના ખેડુતોના નારાજગી વ્યાપી છે. આ બાબતે ઉગ્ર આંદોલનના ભણકારા વાગી રહ્યા છે.

**ભારે કરવેરાથી બચવા કાયદામાં ફેરફાર
માટે એપલની ભારત સરકાર સાથે વાતચીત**

યુધીમાં ભારતનો હિસ્સો ચાર ગણો વધીને ૨૫% થવાનો અંદાજ છે. એપલના કો-ડ્રાફ્ટ ઉત્પાદક, કોફસકોન અને ટાટાએ પાંચ પ્લાન્ટ ખોલવા માટે અખજો ડોલર ખર્ચ્યા છે, પરંતુ આ નાણાંમાંથી લાખો ડોલર આઈકોન એસેમ્બલી માટે મોંઘી મશીનરી ખરીદવામાં જાય છે. જો એપલ ભારતમાં વપરાતા ઉપકરણોની વિદેશી માલિકી અંગેના કાયદા મદદશવા માટે ભારત સરકારને સહજીવ્યા વિના તેની વ્યવસાયિક પદ્ધતિઓમાં ફેરફાર કરે છે, તો તેને અખજો ડોલરના વધારાના કરનો સામનો કરવો પડી શકે છે.

સેન્સેક્સના ૩૦ શેરમાંથી ૧૬ શેર વધ્યા અને ૧૪ શેર ઘટ્યા

સેન્સેક્સ ૪૮૪ પોઈન્ટ વધીને ૮૩,૯૫૨

પર બંધ: નિફ્ટી પણ ૧૨૪ પોઈન્ટ વધ્યો

મુંબઈ, તા. ૧૭

આજે ૧૭ ઓક્ટોબર સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ ૪૮૪ પોઈન્ટ વધીને ૮૩,૯૫૨ પર બંધ થયો. નિફ્ટી પણ ૧૨૪ પોઈન્ટ વધીને ૨૫,૭૦૯ પર બંધ થયો. સેન્સેક્સના ૩૦ શેરમાંથી ૧૬ શેર વધ્યા અને ૧૪ શેર ઘટ્યા. એશિયન બજારોમાં કોરિયાનો કોસપી ૦.૦૧૪% વધીને ૩,૭૪૮.૮૯ પર બંધ થયો, અને જાપાનનો નિકેી ૧.૪૪% વધીને ૪૭,૫૮૨.૧૫ પર બંધ થયો. હાંગકોંગનો હેંગ સેંગ ઈન્ડેક્સ ૨.૪૮% વધીને ૨૫,૨૪૭.૧૦ પર બંધ થયો, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ૧.૯૫% વધીને ૩,૮૩૯.૭૬ પર બંધ થયો. ૧૬ ઓક્ટોબરના રોજ, યુએસ ડાઉ જોન્સ ૦.૬૫% વધીને ૪૫,૯૫૨.૨૪ પર બંધ થયો. નાર્સેક કમ્પોઝિટ ૦.૪૭% વધીને ૦.૬૩% વધીને ૪૫,૯૫૨.૨૪ પર બંધ થયો. ૧૬ ઓક્ટોબરના રોજ વિદેશી રોકાણકારો (FII)

એ રોકડ સેગમેન્ટમાં રૂ.૯૯૯.૨૯ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી અને સ્થાનિક રોકાણકારો (DII) એ રૂ.૪,૦૭૬.૨૦ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ રૂ.૮૯૦.૩૨ કરોડના શેર વેચ્યા છે, જ્યારે સ્થાનિક રોકાણકારોએ આ સમયગાળા દરમિયાન રૂ.૫૧૭.૮૪ કરોડની ચોખ્ખી ખરીદી કરી છે.

Particulars	₹ in Lacs except EPS				
	Quarter Ended		Half Year Ended		Year Ended
	30.09.2025 (Unaudited)	30.09.2024 (Unaudited)	30.09.2025 (Unaudited)	30.09.2024 (Unaudited)	31.03.2025 (Audited)
Revenue from operations	3484.36	2109.73	6752.32	4129.07	9750.88
Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	247.87	(150.58)	492.36	(356.14)	(273.49)
Net Profit for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	247.87	(150.58)	492.36	(356.14)	537.74
Net Profit for the period after tax	185.44	(112.70)	368.44	(266.70)	397.59
Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	185.44	(112.70)	238.44	(266.70)	397.59
Paid up Equity Share Capital (Face value of Rs. 10/- per share)	4881.00	4061.00	4881.00	4061.00	4061.00
Reserves excluding Revaluation Reserves (as per balance sheet of previous accounting Year)	—	—	—	—	(3147.56)
Earnings per Share (of Rs. 10 each) (not annualised) Basic & Diluted:	0.38	(0.28)	0.75	(0.66)	0.98

Notes:


1) The key standalone financial information of the Company is as under:

Particulars	Quarter Ended		Half Year Ended		Year Ended
	30.09.2025	30.09.2024	30.09.2025	30.09.2024	31.03.2025
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
Revenue from operations	3484.37	2109.72	6752.32	4129.07	9750.88
Profit before tax	248.21	(150.25)	493.04	(355.55)	(272.21)
Profit after tax	185.74	(112.43)	368.95	(266.22)	398.55

2) The above is an extract of the detailed Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results (Consolidated/Standalone) are available on the website i.e. www.seprow.in and on the Stock Exchanges' websites i.e. www.bseindia.com and www.nseindia.com.

3) The same can be accessed by scanning the QR code provided below:

Place : Vadodara
Date : 17.10.2025



For and on behalf of Board of Directors
Sd/-
(SACHIN AGARWAL)
Managing Director

કરજણ-વાડી સિંચાઈ યોજનામાં વધારાની ગ્રાન્ટની ફાળવણી કરો :- સાંસદ મનસુખ વસાવા

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં કરજણ જળાશય યોજનામાં વિશ્વકર્મી સિંચાઈ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. જેનું લોકાર્પણ થયું છે. પરંતુ આ પ્રોજેક્ટનું પાણી પાણી-કોટરામાં છોડવામાં આવે છે. જે તે સમયે ખેડુતોને સમજાવ્યું હતું કે, તમારા ખેતરો સુધી આ સિંચાઈ પાણી મળવાનું છે, અને અમારી વાતને ધ્યાનમાં લઈને ખેડુતોએ સહકાર આપ્યો હતો. પરંતુ ખેડુતોને પાણી નહીં મળતાં આ પ્રોજેક્ટમાં વધારાની ગ્રાન્ટ આપી ખેડુતોને સિંચાઈનું પાણી આપવું જોઈએ.

માટેનું પાણી આપવાનું હતું તે ઉપરાંત પાણી વ્યાપી છે. આ બાબતે પ્રકારની કામગીરી નહીં કરતાં ઉગ્ર આંદોલનના ભણકારા વાગી આવવાથી વિસ્તરના ખેડુતોમાં રહ્યા છે.

અંકલેશ્વર,તા.૧૭
ભુપેન્દ્ર પટેલની સરકારના
મંત્રીમંડળમાં અંકલેશ્વર હાસોટના
ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને
સ્થાન પ્રાપ્ત થયું છે. ઈશ્વરસિંહ
પટેલે રાજ્યકક્ષાના મંત્રી સ્વતંત્ર
પ્રભાત તરીકે ગ્રહણ કર્યા હતા.
ત્યારે તેઓના વતનમાં ઉત્સવનો
માહોલ જોવા મળ્યો હતો.ભુપેન્દ્ર
પટેલ સરકારના મંત્રીમંડળનું
વિસ્તરણ કરવામાં આવ્યું છે જેમાં
અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ
પટેલને સ્થાન મળ્યું છે. ઈશ્વરસિંહ
પટેલે રાજ્યકક્ષાના મંત્રી સ્વતંત્ર
પ્રભાત તરીકેના શપથ ગ્રહણ કર્યા
હતા ત્યારે તેમના વતન કુડાદરા
ગામ અને પંડવાઈ સુગર કેન્ડરી
ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો
હતો. પ્રામજનો અને આગેવાનો
દ્વારા કાકડકા ફોટી ખુશી મનાવવામાં

[illegible]

ટ્રેન નંબર	મૂળ સ્ટેશન અને ગંતવ્ય સ્થાન	સેવાની તારીખો	પ્રસ્થાન	આગમન
૦૪૮૨૬	બાંદ્રા ટર્મિનસ - બોધપુર (સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ)	૨૩.૧૦.૨૦૨૫ અને ૩૦.૧૦.૨૦૨૫	૨૧:૨૦ કલાક (ગુરુવાર)	૨૧:૪૫ કલાક (બીજી દિવસ)
૦૪૮૨૫	બોધપુર - બાંદ્રા ટર્મિનસ (સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ)	૨૨.૧૦.૨૦૨૫ અને ૨૯.૧૦.૨૦૨૫	૧૭:૩૦ કલાક (બુધવાર)	૧૮:૨૦ કલાક (બીજી દિવસ)

સોકાઇ: બોલીવીલી, વાપી, સુરત, બરુચ, વડોદરા, રતલામ, કોટા, સવાઈ માધોપુર, જયપુર, કુંભેર, નવા સિટી, કુચમન સિટી, મકરાણા, દેગાના, રેન, મેતાં રોડ અને ગોતાન સ્ટેશન બંને ડિસ્ટામાં.

રચના: એસી ૨-ટાયર, એસી ૩-ટાયર, સ્વીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ.

સમય, સોકાઇ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને
www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

ટ્રેન નંબર ૦૪૮૨૬ માટે બુકિંગ ૧૮.૧૦.૨૦૨૫ થી બધા પીઆરએસ કાર્ડનર અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન ખાસ ભાડા પર ખાસ ટ્રેન તરીકે દોડશે.



પશ્ચિમ રેલવે
wr.indianrailways.gov.in
 અને લાયક સેલ ફોન: [facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)
 અને ટ્વિટર: [@WesternRly](https://twitter.com/WesternRly)
 અને ઇમેઇલ: enquiry@wr.indianrailways.gov.in

કૃપા કરીને બાદી અદક્ષિત ટિકિટો માટે મૂળ ઓળખપત્ર સાથે રાખો.



MGVCL

MADHYA GUJARAT VIJ COMPANY LTD.

ISO-9001-2008 Certified Company

O&M) Circle Office, 3rd Floor, Nagar Palika Bhavan, NADIAD-387001

Ph. No. (0268) 2562204 / 2562208 Fax No. (0268) 256229

Public Notice

Tender Notice No.22/25 Tenders are invited vide 1) Tender ID No 234361 ARC for Laying of underground 11 KVXLPE cables of any rating from 95 to 240 sq.mm including beneath road crossing as per specification / scope of work, terms and condition of tender including the liaison work with government authority as per attached schedule for Nadiad Rural Sub Division/ other Sub Division under ND & Other scheme.2). Tender ID No 234416 ARC for Laying of underground 11 KVXLPE cables of any rating from 95 to 240 sq.mm including beneath road crossing as per specification / scope of work, terms and condition of tender including the liaison work with government authority as per attached schedule for Piplag Sub Division / other Sub Division under ND & Other scheme. 3). Tender ID No 234153 ARC for erection and Maintenance of HT/LT/ TC including the rate of Nut-Bolt at Kheda S/dn and any otherS/Sdns under Mahemdabad division (Including GST) 4). Tender ID No 234176 ARC for erection and Maintenance of HT/LT/ TC including the rate of Nut-Bolt at Haldarwas / dn and any otherS/Sdns under Mahemdabad division (Including GST) 5). Tender ID No 234206 ARC for erection and Maintenance of HT/LT/ TC including the rate of Nut-Bolt at Mahemdabad s/dn and any other Sdns under Mahemdabad division (Including GST). 6). Tender ID No 234261 ARC for erection and Maintenance of HT/LT/ TC including the rate of Nut-Bolt at Limbasi S/dn and any other Sdns under Mahemdabad division (Including GST). Date extended up to 28.10.2025 Tender ID No.220548 Outsourcing the services of Meter reading through GPRS based Mobile devices and On spot bill generation, on spot printing of bills and on spot delivery of bills with your Manpower, Mobile device, Bluetooth Printer and Stationary using Android Mobile Application, Web Based Software and Server / Network infrastructure of MGVCL for Piplag and Chaklasi Sub divisions of Nadiad City Division office. Date:17.10.2025

Superintending Engineer, (O&M), MGVCL, C. O. Nadiad

Superintending Engineer, (O&M), MGVCL, C. O. Nadiad



बैंक ऑफ बरौडा
Bank of Baroda

बैंक ऑफ बरौडा - पोर साणा
ग्रांथी शोणींग सेलर, पोर, वडोदरा-३६१२४३,
फोन: ०२६५-२८३००५५, ईमेल: por@bankofbaroda.com

सुधारा

अमे बैंक ऑफ बरौडा ना अधिष्ठत अधिग्राहीनी इंधेणे नीचे जहावेत लाडी करडार /भोटेनेजर श्री सुधांत भेरा नी पडोनेल नीटीस ता.१७.१०.२०२५ ना रोप लोकरता गुणरातीना (प्रभावित करेल) रेमा पडोनेल नी प्रकर सांकेतित करणे नेमावेले थे जे नेने सुधारीने प्रत्यक्ष करणे वेंचे वांयचु. नीटिसमां उडेजित अनर्थ तमाग नियमो अने शरतो राबेता मुजब रहेंवे.

स्थण: पोर, वडोदरा, ता.: १८.१०.२०२५ **अधिष्ठत अधिग्राही, बैंक ऑफ बरौडा**



बैंक ऑफ बरौडा
Bank of Baroda

पडोदरा महानगरपालिका

अड्डेडोल हाउसींग विभाग
प्रधानमंत्री आपास योजना

“व्याजही लावे घर भेगवपांनी अमुत्य तक”

मात्र **रु.५० लाख** मागेवत आदालत सुविधाही सख आपासो
(इस्त रु.३०,२०० लेनी ओनलार्गन अरल करी शकासे)

कटाली रे.स.नं.५८५-५८५ (संभालांन) : भिजकोली रूड-सुधी नीगाज जता, जगनाथ महादेव मॉडर घरो, कटाली रोड, (कटाली) पातोना एक्स-२५ प्रकरणा ने डूम- रस्सोडाल आपासो हेडल पोताना रापनालां घुर भेगवपा माटे आजे ज अरल करे.

वधु मार्गदर्शन तेमज ओनलार्गन

अरल करपा माटे QR कोड स्कॅन करे.

नीय-ता.५८/१५/१५ रासणांन ०९.०० घाटा सुधी लेनी लेनी शकासे.

वधु मांडेसी माटे अड्डेडोल हाउसींग विभागांनी डबरी, कंथा शाणा नं.३, रावपास माते सांक्ष करे.

पि.आर.ओ.नं. ७५५/२५-२६



अड्डेडोल हाउसींग सेल व्पारा प्रडाशित

[illegible]

 <p>बैंक ऑफ बरોडा Bank of Baroda</p>	<p>બેંક ઓફ બરોડા-લતરાસ શાખા મુકામ - લતરાસ, પોરબંદર જિલ્લાના, જાગી-વડોદરા-૩૬૦૦૧૨, ગુજરાત, દિલ્હી-૩૦, ૯૦૯૯૯૫૫૩૨. પીસીટાલસા@bankofbaroda.com</p>
<p>APPENDIX IV [See Rule 8(i)] નિલકલતા કબજાને લગતી સુચના (અચલ નિલકલત)</p>	
<p>નીચે સહી કરનાર સાક્ષીગૃહ/અંગણવાસી એન્ડ રીઝર્વેશનના આંશ ફાનાનીસાથ અંગેસેડ એન્ડ એન્ડોર્સમેન્ટ સાક્ષીગૃહની ઈલેક્ટ્રેન્ડ એન્ડ રીઝર્વેશન તે સહમત ૧૩(૧)(૧) ના (નિયમ - ૮) ની સાથે સાંપાંચી સાક્ષીગૃહની ઈલેક્ટ્રેન્ડ (એન્ડોર્સમેન્ટ) રૂલસ ૨૦૨૦ મેબાલા અધિકારી હેલ્થ બેંક ઓફ બરોડા ના અધિકૃત અધિકારીની રૂબરૂ નીચે જણાવેલા બાકી કરજદાર/</p>	<p>/મોટેરગૃહ જી બાબુસ સરદારને ને ડીમાન્ડ નોટીસ તા.૧૨.૦૫.૨૦૨૫ (૧૯.૦૭.૨૦૨૫ ના રોજ તે સામાયારગૃહમાં પ્રકાશિત) ના પાઠવેલી નોટીસ માં બાકી ખાતેદાર સામે દર્શાવીલી રકમ રૂ. ૨૯.૦૬, ૨૦૨૫/- (રૂપિયા ઓગણસી લાખ પંચાણ્ણ હજાર બસો ઓગણસેવી પચાણ્ણ) તા. ૧૨.૦૫.૨૦૨૫ ના રોજ (૧૨.૦૫.૨૦૨૫ સુધીના વ્યાજ સહિત) નોટીસની તારીખ/ઉકલ નોટીસ પ્રમાણી તારીખથી ૧૦ દિવસની અંદર વ્યાજ એન્ડે અર્જ સામે બરખાઈ કરચા જણાવેલા.</p>
<p>કરજદાર/જમીનદાર/મોટેરગૃહ નીચે જણાવેલી રકમોની પરત ચુકવેલી કરવામાં નિયત્ત ગયા હોવાથી, આ સાથે બાકી કરજદાર/જમીનદાર/મોટેરગૃહ અંને જાહેર જનતાને જણાવવામાં આવે છે કે નીચે સહી કરનારે એને આવેલા કોટરમાં દર્શાવેલી નિલકલતનું પરત જણાવેલા નીચામોના નિલકલતની ઈલેક્ટ્રેન્ડ એન્ડોર્સમેન્ટ રૂલસ ૮ ને સંબંધિત કલમ ૩૨(૪) સાથે પરકલમ એક્ટ વાંચતા લેવે/તેલોની પ્રાપ્ત થવી સત્તાએ અનુસાર નિલકલત નો સામેતિલ કબજો છે. ૧૩.૧૦.૨૦૨૫ ના રોજ લીધે છે.</p>	<p>બાકી કરજદાર/જમીનદાર/મોટેરગૃહ તથા સામાન્ય સંદર્ભમાં જાહેર જનતાને અંને નીચે જણાવેલી અનુસુચિત નિલકલતની બાબતમાં કોઈપણ પ્રકારનો વ્યવહાર કે લેવે દેવ કરવા ન કરવા વગેરેથી આપવામાં આવે છે, એલે બેંકોના, લતરાસ શાખા ની લેણી રકમ રૂ. ૨૯.૦૬, ૨૦૨૫/- (રૂપિયા ઓગણસી લાખ પંચાણ્ણ હજાર બસો ઓગણસેવી પચાણ્ણ) તા. ૧૨.૦૫.૨૦૨૫ ના રોજ (૧૨.૦૫.૨૦૨૫ સુધીના વ્યાજ સહિત એને તેના પરત વ્યાજ ઉપરાંત અન્ય શુલ્ક ના બોજોમાં આદીન.</p>
<p>દેવાદારને ધ્યાન દોરવામાં આવે છે કે પોતાની નિલકલત સેશન ૧૩ ના એક્ટ હેઠલ સમ સેશન (૮) મુજબ નિલકલત મેળવવા સરખ ભરવા સમયની જોગવાઈ કરવામાં આવી છે.</p>	
<p>અચલ સંપત્તી નું વર્ણન</p>	
<p>તામબ ભાગ એને હિસ્સે ઈલેક્ટ્રેન્ડ સુપર ફેરલાઈફ કલેત ને. એચ-૧૦૨ ટાવર-એચ, પહેલા તામબ નું સેશન ૯૧.૯૯ ચોરસ મીટર સુપર ફેરલાઈફ અંને અંતિમાભુત્ત હિસ્સો પ્રમાણસાર જમીન એટીશન બાબત સમ ૩૯.૫૨ ચોરસ મીટર ને આવલ રકમી 'શરશી ઓગણએક્ટ અને પેન્ડેલાઈફ' તરીકે ઓગણાણે તે નું નું બાંધકામ યિન પ્રોતીયાસ જમીન પર કરલે નો વેલોડ ને. ૬૯૦, જુનો સર્વેય ને. ૭૬૪/૨ પેત્રી તેત્રી સેશન ૯૨૦૭.૦૦ ચોરસ મીટર મોજે ભાચલી, તાલુકો વડોદરા નો રજીસ્ટ્રેશન જાગી એલ સમ જાગી વડોદરા, ગુજરાત. નિલકલતની ચુલસીના: પૂર્વ: કલેત ને. એચ-૧૦૩, પશ્ચિમ: લેકટ ટાવર નો ઓપન સ્પેસ, ઉત્તર: ઓપન સ્પેસ, દક્ષિણ: લીકટ.</p>	<p>તા. ૧૩.૧૦.૨૦૨૫ રૂ. ૧૯.૧૦.૨૦૨૫</p> <p>નોંધ: પિલાદની સ્થિતિમાં આ નોટીસનો અર્થ અનુબદ્ધ માન્ય થશે.</p> <p>અધિકૃત અધિકારી બેંક ઓફ બરોડા</p>

[illegible]